

મહેસૂલ વિભાગના ટ્રાવ કમાંક:- સીએલઅસ/૧૦૨૦૧૨/૨૫૩/સ.૩,

તા. /૦૯/૨૦૨૧ માં ઉદ્દેખ કર્યા મુજબના અરજી ફોર્મનો નમુનો

૧	અરજદારની વિગત	
નામ		
ઉંમર		
મૃતક સાથેનો સબંધ		
રહેઠાંણનું સરનામું (પુરાવાની નકલ સામેલ રાખવી)		
ધંધો (નોકરી/ધંધો/ખેતી/છુટકમજુરી/અન્ય)		
મોબાઈલ નં.		
આધાર કાર્ડ નં. (નકલ સામેલ રાખવી)		
૨	કોવિડ-૧૯(કોરોના) થી મૃત્યુ પામનારની વિગત	
નામ		
ઉંમર		
જાતિ (સ્ત્રી / પુરુષ)		
મૃતકનો ધંધો (નોકરી/ધંધો/ખેતી/છુટકમજુરી/અન્ય)		
રહેઠાંણનું સરનામું		
આધાર કાર્ડ નં. (નકલ સામેલ રાખવી)		
કોવિડ-૧૯(કોરોના) પોઝિટિવ આવ્યા તારીખ		
કોવિડ-૧૯(કોરોના) થી મૃત્યુ પામ્યા તારીખ		
૩	મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબના પ્રમાણપત્રની નકલ જોડવી કે જેમાં મૃત્યુના કારણ તરીકે કોવિડ-૧૯(કોરોના) દર્શાવેલ હોવું જોઈએ.	પ્રમાણપત્ર જોડેલ છે? હા / ના

જ	મૃતકના વારસદારની નામ-સરનામાં સાથેની વિગત	
પ	સહાયની રકમ જો કોઈ એક વારસદારના નામે લેવાની હોય તેની વિગતો (એક કરતાં વધુ વારસદાર હોય તો અન્ય વારસદારોની સમંતિ સાથેનું એફિડેવીટ રજૂ કરવું)	એફિડેવીટ જોડેલ છે? હા / ના
ક	જેના નામે સહાય લેવાની હોય તે વારસદારની બેંકની વિગતો (બેંક પાસભુકની નકલ સામેલ રાખવી)	બેંકનું નામ:- ખાતા નંબર:- ખાતા ધારકનું નામ:- IFSC કોડ:- બ્રાન્ચનું નામ:-

અરજદારની સહી :-

નામ:-

સ્થળ :-

તારીખ :-